




Save Water




Save Tree



Save Energy



Save Earth



ઉપકાર તારા છે અગણ્ય
હ તરુવર! શું કહું?
તારા થકી આ અન્નપાણી
શુદ્ધ હવા છું ગ્રહી;
પ્રકૃતિની સચતા ને
સાહાબી સૃષ્ટિદાથી -
તેં ઘણુંયે દઈ જ દીધું,
ઓર ઝાઝું શું ચહું?

વૃક્ષો છે મિત્રો
એવું તો ઘણું બોલ્યા
પણ નિભાવ્યું?

રિકિતા પટેલ, 9 E, VVM

કરે સંઘર્ષ
પર્યાવરણ કાજે
વૃક્ષ એકલું.

આદેશ કોડિયા, 9 D, VVM

Vision Green



વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ.

- ઉમાશંકર જોષી

Vision Green

પ્રકાશક :

સંસ્થા માહિતી વિભાગ
વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર

ઉપક્રમ:

ગાંધીબુદ્ધ સ્વાધ્યાય કેન્દ્ર આયોજિત
'વિઝન ગ્રીન-2011-12 પ્રકલ્પ વર્ષ'

સંપાદક અને સંકલક :

શ્રી ભાનુપ્રસાદ રાવલ
સંયોજક, ગાંધીબુદ્ધ સ્વાધ્યાય કેન્દ્ર

શ્રી દિવાળીબેન પટેલ

મ. શિ., શ્રી સી. કે. મહેતા પ્રે.શાળા

શ્રી મહેન્દ્રભાઈ પરમાર

મ. શિ., શ્રી રાજમણિ પ્રા.શાળા

2001-02	: મહાત્મા ગાંધીજી
2002-03	: સરદાર વલ્લભભાઈ પટેલ
2003-04	: મહાવીર સ્વામી
2004-05	: ભગવાન બુદ્ધ
2005-06	: સ્વામી વિવેકાનંદ
2006-07	: રવીન્દ્રનાથ ટાગોર
2007-08	: મીરા
2008-09	: સંત કબીર
2009-10	: ડૉ. વિક્રમ સારાભાઈ
2010-11	: અબ્રાહમ લિંકન
2011-12	: વિઝન ગ્રીન-2011-12
2012-13	: ઝવેરચંદ મેઘાણી

CELEBRATING
60 YEARS



Vidyamandir Trust, Palanpur

Taleybaug, Palanpur-385 001

Dist. Banaskantha (N Gujarat)

Tel: (02742) 250215

Fax: (02742) 265139

Email: centraloffice@vidyamandir.org

Web:www.vidyamandir.org

પ્રાકૃત્યન

હસમુખ મોદી

કાર્યકારી નિયામક, વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર.

વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર સંચાલિત ગાંધીબુદ્ધ સ્વાધ્યાય કેન્દ્ર પ્રતિવર્ષ કોઈ એક મહાનુભાવના જીવનચરિત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે. માનવજીવનના પથદર્શક આ મહાનુભાવોનો જીવન સંદેશ આપણા પ્રત્યેક વિદ્યાર્થી-અભિભાવક સુધી પહોંચે તેમજ આપણા સૌનું જીવન ઉત્તર બને એવા શુભ આશય સાથે આ કેન્દ્ર કાર્યરત છે.

ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ આ કેન્દ્ર આયોજિત વિવિધ સ્પર્ધાઓ, પ્રવચનો, વાર્તાલાપો વગેરેમાં જોડાય છે. શાળાસ્તરે વિવિધ પ્રવૃત્તિઓ યોજીને તેમજ સંસ્થા મુખપત્ર 'નિષ્ઠા'ના માધ્યમથી આ મહાનુભાવોનાં જીવનકાર્યોની સુવાસ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે. શાળાની પ્રાર્થના સભાઓમાં નિયમિત આ મહાનુભાવોના જીવનચરિત્ર પર આધારિત ફિલ્મ, નૃત્યનાટિકા વગેરેનું દર્શન વિદ્યાર્થી માટે રોચક અને પ્રેરણાદાયી બની રહે છે.

શાળામાં પ્રતિવર્ષ યોજાતા રંગોત્સવમાં પણ આ મહાનુભાવોને કેન્દ્રમાં રાખી વિશિષ્ટ કૃતિઓની રજૂઆત કરવામાં આવે છે. મહાનુભાવોના જીવનચરિત્ર પર આધારિત ક્વિઝ, લેખિત પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવે છે.

આ સંસ્થાના ઉપક્રમે વર્ષ 2011-12માં વિઝન ગ્રીનનો જીવન સંદેશ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ.

વિઝન ગ્રીનના સંદેશને નાની પુસ્તિકારૂપે આપ સૌના સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. આશા છે કે કેન્દ્રનો આ પ્રયાસ આપ સૌને ગમશે.

વર્ષ 2012-13 માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે પ્રવૃત્તિઓ યોજાશે.

આ પુસ્તિકામાં પ્રદર્શિત ચિત્રો વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સ્વયં દોરેલાં છે. કાવ્યો - પંક્તિઓનું સર્જન તથા સંકલન પણ વિદ્યાર્થીઓ દ્વારા થયું છે. વિવિધ સંસ્થાઓમાં વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ તથા કાર્યક્રમોના શેટોગ્રાફ્સ પ્રદર્શિત છે.

વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ કેમેરાની નજરે



મખ્યું જીવન
તુજ દેહ તત્વથી
રકુ નિરોગી

હું છુ સુગરી બાંધવો માણો મારે,
પશ શું કરું હું ક્યાંય નથી જગ્યા !

ચાલો પૂછીએ વૃક્ષને
તેના નામનો મતલબ,
વૃક્ષ આપણને પ્રેમનું
સમજાવશે ઉપનિષદ

વૃક્ષોનું ન કાઢું નિકંદન
ભાવિ કરશે વંદન

જગનું જીવન વર્ષારાણી
વૃક્ષો લાવે તાણી....તાણી....

Tree are life line of man life

Tree are the kindness things know,
They give us joy and save us

Grow more trees, Get more rains

I have not time
I am not free
Still, I am good friend of tree
In this world of Machine and motor
do not forgot give it water
It gives us to cooling like freez
Dont cut it, please save the tree

It is important to note that even though the problem of making our planet green is big now. Each one of us can make a difference if we decide to fine tune our life style.

The awareness of environmental Issues that affect the future of the planet.

Think green.....go green...live green
for the
smiling world.

Sr.	Institution	First prize	Second prize	Third prize
1	Shri Jain Balmandir	1	1	1
2	Smt. K. R. Parikh Balmandir	1	1	1
3	Shri C. R. Mehta Balmandir	1	1	1
4	Smt. M. M. Mehta English Medium Balmandir	2	2	2
5	Shri Jain Shishushala (Early Childhood) Std. 1 & 2	13	9	9
6	Smt. M. M. Mehta Eng. Med. (Early Childhood) Std. 1 & 2	18	8	8
7	Shri Rajmani Primary School (Elementary) Std. 3 to 5	20	15	15
8	Smt. M. M. Mehta Eng. Med. (Elementary) Std. 3 to 5	27	11	11
9	Vinaymandir	22	14	14
10	Shri Vividhlakshi Vidyamandir	17	9	8
11	Shri K.M.Chokshi High.Sec.School	4	4	4
12	Smt. M. M. Mehta Eng. Med. School (Std. 6 to 12)	10	10	10
13	Maa Shravanvani Mukbadhir Vidyalaya	15	10	10
14	Smt. I.R.Mehta 'Anand Niketan'	3	3	3
15	Shri M.K.Mehta School for the Visually Impaired	5	5	5
16	Shri K.J.Mehta College of Pre-Primary Education	4	4	4
17.	Shri C.K.Mehta College of Primary Education	9	9	10
18.	Shri D.D.Choksi College of Secondary Education	7	7	4
Total : 422		179	123	120



make planet earth smile



Together we can & we will make the difference.



Smiling world

Steps of think Green

- Save Trees
- Save Water
- Save energy
- Save electricity
- At work
- In Kitchen
- With cars
- Public Transportation
- In Bathroom
- Recycling
- When gift giving
- Stop Global warming



Trees are our family

Trees are our family,
We can't live without them
When I found trees, the trees found me,
I think that I shall never see
A poem lovely as a tree.

A tree whose hungry mouth is prest
Against the sweet earth's mouing breast
A tree that looks at god all day,
And lifts her leafy arms to pray
A tree that may in summer wear
A nest of rdins in her hair,
Upon whose bosom snow has lain
Who intimately lives with tree.

Poems are made by foods like me,
But only God can make a tree.

Dhvij Patel
6th EMS

મને એક એક ઝાડની માયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ' પરાયાં

ઝાડ પર ફૂલ થઈને ફૂટુંને
પંખી થઈ બાંધુ હું માળો
ખિસકોલી થઈને હું દોડ્યાં કરું છું ભલે
ઉનાળો હોય કે શિયાળો.

એક એક ઝાડની છાયા
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ' પરાયાં

ઝાડની હું ડાળી ને ઝાડનું થડ હું તો,
પાંદડા ને ઝાડનું હું મૂળ છું.
ઝાકળની જેમહું તો વળગું છું ઝાડને,
સોનેરી કિરણોની ધૂળ છું.

લીલા લીલા વાયરા વાયા,
કે ઝાડ મને લાગે નહીં કોઈ દિ' પરાયાં

-ઈશા જોષી, ૬-બ વિનયમંદિર



ખડે ખડે મુસ્કાતે પેડ
કહિ ન આતે- જાતે પેડ
જંગલ હો યા તડક -ભડક હો,
પર્વત ઘાટી ખુલી સડક હો,
વાદલ બીજલી તેજ કડક હો,
કિન્તુ નહીં ઘવરાતે પેડ ।
સૈનિક સે ડર જાતે પેડ
હેરે ગુલાવી ગહને પહને
સીખ ગયે સબ આતપ સહને
ખિલના હમે શિખાતે પેડા
સુંદર દૃશ્ય દિખાતે પેડ ॥

-દિનેશ બળોલિયા



- સૈનિકા : રક્ષન્તિ દેશ : ।
વૃક્ષ નારાયણા રક્ષન્તિ પર્યાવરણમ્ ॥
- યત્ર અવકાશ: તત્ર વૃક્ષારોપણં ।
કૃત્વા ગુર્જરભૂમિમ્ રમ્યં કરણીયમ્ ॥
- શુદ્ધ પર્યાવરણ: હવ સમૃદ્ધ દેશસ્ય મૂકદર્શનમ્ ।



પેટ કા ભોજન હું, શરીર કા વસ્ત્ર હું
 પર આજ મેં ત્રસ્ત હું,
 હોં મેં વૃક્ષ હું।
 જીવન કી હવા હું, રોંગીયો કી દવા હું,
 પર આજ મેં રોગ સે ત્રસ્ત હું,
 હોં મેં વૃક્ષ હું।
 સૌંદર્ય કા વોધ હું, વૈજ્ઞાનિકો કી શોધ હું,
 પર આજ મેં શોકત્રસ્ત હું,
 હોં મેં વૃક્ષ હું।
 ધરતી કા સિંગર હું, વર્ષા કી કહર હું
 પર આજ મેં અકાલત્રસ્ત હું,
 હોં મેં વૃક્ષ હું।

-ઠાકર હિતાલી બી., ધો. ૧૦ ક

વૃક્ષ
 એટલે?

ઋષિની જેમતપસ્યા કરતો જીવ,
 એક સંતની જેમશીતળતા આપનાર, સહન કરનાર
 કે પછી એક દાક્તરની જેમરોગ દૂર કરનાર
 વૃક્ષો આપણને શું નથી આપતાં?
 જીવસૃષ્ટિનું એક મહત્વનું પાસું છે વૃક્ષ
 જાગો મિત્રો હવે જાગવાનો સમય આવ્યો
 પહેલાં દેશની આઝાદી માટે લડ્યા, જાગૃત થયા
 હવે, આપણા ભવિષ્યના જીવન માટે, લાપરવાહ
 શા માટે?
 વૃક્ષ બચાવવા લડીએ
 આપણે હરિયાણી લાવીએ, અને વૃક્ષને બચાવીએ
 વૃક્ષ ઉગાડીએ, પર્યાવરણ બચાવીએ.

નિતીન પરમાર (બી.એડ.)



જેનાં ફળ સંતાઈ- સંતાઈ ભૂટ્યાં,
 તે પરોપકારી મિત્રો આજે છે ખૂટ્યાં,
 ડાળી વૂટી જેની આપણને ઝુલવતાં,
 ચાલો હાથ મિલાવીએ તેને બચાવવા.

Think Green



Save Trees

The strongest way to protect the environment is to save trees. Trees are one of the main creations of God that play an important role to keep air clean. If there will be no fresh air available then how human being, animals and birds will survive; therefore a clean environment is the need for every living object on this earth. Planting a tree can stop the sea level from rising the icecaps from melting and hurricanes from intensifying it also confirms the notion that planting more trees in tropical rain forests could help slow global warming world wide. There are many things you can do to save trees

- વધુને વધુ વૃક્ષો ઉછેરો
- અત્યંત જરૂર ન હોય ત્યાં સુધી વૃક્ષો કાપો નહિ
- કાગળના ઉપયોગ વગર સંદેશાની આપલે કરો.
- લેખિત પરીક્ષા પદ્ધતિને બદલે ઓનલાઈન એક્ઝામપદ્ધતિનો ઉપયોગ કરો.
- Paper towel નો ઉપયોગ ઓછો કરો એની જગ્યાએ Cloth towel અને હાથરૂમાલનો ઉપયોગ કરો.
- કાગળને રિસાઈકલ કરી ફરી વાપરો.

Save Water

There is no resource more precious than water. There is also no resource that is misused, abused, misallocated and misunderstood the way water is! safe drinking water healthy and intact natural ecosystems and a stable food supply are a few of the things at stake as our water supply is put under greater and greater stress.

- નળને પૂરેપૂરો બંધ કરો. ટપકતા અટકાવો.
- છોડને પાણી પાવા, બગીચા માટે અને જરૂરી સફાઈ સિવાય પાણીને બિનજરૂરી ઢોળવું નહિ.
- ટોઈલેટમાં ફ્લસીંગ કરવાનું ટાળો.
- બ્રશ કરતાં, દાઢી કરતાં, હાથઘોતાં વોશબેઝીનનો નળ ચાલુ ન રાખો.
- એરકુલર, એરકન્ડીશનર, રેફ્રીજરેટર, જેવાં ઘરવપરાશનાં સાધનમાં થતો પાણીનો વ્યય અટકાવો.



ચાલ દોસ્ત ! ઝાડની ખબર કાઢવા જઈએ,
ઉપડી છે એક કુહાડી એને રોકવા જઈએ.
વસ્યો છે શ્વાસ આપણો પર્યાવરણના શ્વાસમાં
એ દુનિયાને સમજાવીએ.
ચાલ દોસ્ત ! ઝાડની ખબર કાઢવા જઈએ,
'ઘનને વાપરતાં શીખો!' વૃક્ષને બચાવતાં શીખો;
એ સૂત્ર જીવનમાં ઉતારીએ
બનશે ભોગ આવનારી પેઢી
આપણા કાર્યોની,
એ સત્ય ખુલ્લુ પાડીએ.
ચાલ દોસ્ત ! ઝાડની ખબર કાઢવા જઈએ,

- સોનલ દેસાઈ,
શ્રી ડી.ડી.ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, પાલનપુર.



Tree

When I behold tree
I feel more tree

It takes my worries away
And fills joy and tranquility
On my way

Oh! Tree, make me free;
From this heinous world
The tweeting of birds make me
More joyous

My doleful days pass in its
embrace

- Surbhi Sharma, B.Ed. College





પ્રકૃતિ સાથેની આપણી સગાઈ

પ્રકૃતિ સાથેની આપણી સગાઈ ફરી ઓળખવાની સમજવાની ઘડી આવી પહોંચી છે. સૂર્ય, ચંદ્ર, તારા, ધરતી, વૃક્ષો આ બધાંને ફરી આપણે આપણા જીવનમાં યથાસ્થાને ગોઠવવાની જરૂર છે. જીવનને માત્ર પોષણ જ નહિ, બળ આપવાની તેની શક્તિ વિશે હવે ખુદ વિજ્ઞાનીઓને પણ શંકા રહી નથી.

આપણા ઘરની આંતરિક સજાવટ અને આપણા જીવનની બાહ્ય સજાવટમાં ભૌતિક સુખસગવડોનો આપણો ખ્યાલ મુખ્ય રહ્યો છે. પણ આપણી પોતાની અંદર જે લીલીછમવાડીનો અહેસાસ આપણને થવો જોઈએ તે થતો નથી. કેમકે એને પાણી અને પોષણ આપનારાં તત્ત્વોની ઉપેક્ષા જ થતી રહી છે. પ્રકૃતિ જ માતા છે અને પોષણ તેની પાસેથી જ મેળવવાનું છે. પંખીઓ, વૃક્ષો, ફૂલો બધું જ અદૃશ્ય થઈ રહ્યું છે.

પશુઓ હવે ઘર, ખેતર કે સીમની શોભા રહ્યાં નથી. કેટલાંક પ્રાણીઓ મહાનગરના રસ્તા ઉપરની અડચણો તરીકે, નઘણિયાતાં બેઠાં હોય છે કે ઘૂમી રહ્યાં હોય છે. આ આખો સવાલ તો બહુ વ્યાપક અને અટપટો છે, પણ માણસોએ પોતપોતાની રીતે પ્રકૃતિ સાથેની સગાઈ ફરી જીવતી કરવાનો વિચાર કરવો પડશે.

માત્ર ઉત્પાદકતા કે ધનલાભ એ જ આપણું શ્રેય નથી એટલું સમજવાની - વિચારવાની જરૂર છે. જીવનને માત્ર પોષણ જ નહિ, પ્રાણની પણ જરૂર છે અને તે બંને માટે પ્રકૃતિ અને પરમાત્માની નજીક જવા સિવાય બીજો વિકલ્પ નથી.




Save Energy

Green energy refers to source of energy that are non-polluting and environment friendly which can renew them naturally. Green energy is also known as sustainable energy, renewable energy or alternative energy.

There are considered green because they reduce carbon emission and pollution. Examples include bio mass, geothermal power, wind power, hydro electricity and solar power. There are so many ways of optimizing your energy consumption.

- વપરાશમાં ન હોય ત્યારે લાઈટપંખા બંધ કરી દો.
- શક્ય હોય ત્યાં સુધી લાઈટને બદલે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરો.
- ટેબલ લેમ્પમાં fluorescent બલ્બનો ઉપયોગ કરો.
- કપડાં ધોવામાં ઠંડા પાણીનો ઉપયોગ કરો.
- હીટર કે એરકન્ડીશનર ચાલુ હોય ત્યારે રૂમનાં બારી બારણાં બંધ કરો.
- કામપૂર્ણ થાય ત્યારે કમ્પ્યુટર બંધ કરી દો.
- પ્રિન્ટીંગનું કામપૂર્ણ થાય ત્યારે પ્રિન્ટર્સ અને મુખ્ય લેસર પ્રિન્ટરને બંધ કરી દઈએ.
- લો વોલ્ટેજવાળા સાધનોની ખરીદી કરીએ.
- સૂર્ય એનર્જીનો ઉપયોગ કરીએ.



Use public Transportation

A man with a plan : if you're not sure you can do the public transportation thing start small with one goal of taking public transportation at least one day a week until you figure out the system before you know it. You'll be making friends and riding along with everyone else.

- લાંબી મુસાફરી માટે બસ અને ટ્રેનનો ઉપયોગ કરો.
- શક્ય બને ત્યાં સુધી ચાલીને સ્કૂલ જાઓ. અથવા અઠવાડિયામાં એક કે બે વાર ચાલીને સ્કૂલે જવાનું રાખો.
- શાળાએ જવા સ્કૂલ બસનો ઉપયોગ કરો.
- સ્કૂટર કે કારને બદલે વધુને વધુ સાઈકલનો ઉપયોગ કરો.



Stop Global Warming

There is compelling evidence. From all over the world that our planets weather and climate patterns are changing droughts, receding glacier and icecaps. Extereme storms rises in ocean temperatures and sea levels, shifts in distribution of organisms and diseases scientists tracking these events over wheminly believe that global climate change is a fact. There are many simple things you can do in your daily life what you eat, what you drive, how you build your home that can have an effect on your immediate surroundings here is a list of few things that you can do to make a difference.

- Use compact fluorescent Bulbs. કોમ્પેક્ટ ફ્લ્યુરોસન્ટ બલ્બનો ઉપયોગ કરો.
- Change your air filter દર માસે એર ફિલ્ટર ચેક કરો અને બદલો.
- Use recycled paper. રિસાઈકલ થયેલો કાગળ વાપરો.
- Change the AC filter એરકન્ડીશનરને ચેક કરી સમયાંતરે એસી ફિલ્ટર બદલતા રહો.
- Plant a tree વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડનું શોષણ કરી હવાને શુદ્ધ કરે છે. વધુ વૃક્ષો વાવો.
- Be sure your material gift will get used. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જાતે જ ગિફ્ટ તૈયાર કરી આપો.
- Leave the car at home. ઓછા અંતર માટે પબ્લીક ટ્રાન્સપોર્ટ અને બાઈસીકલનો ઉપયોગ કરો.
- Energy Efficient cooking રસોઈ માટે સૂર્યકૂકરનો ઉપયોગ કરો.
- Bring your lunch to work in a cloth bag. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને કપડાની થેલી વાપરો.

